

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૨/૦૩/૨૦૧૬ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધીધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૨૯/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૩ કેસ કરી ૩૪ વ્યક્તિઓને ઝડપી ૨૩૪ લીટર દેશી દારૂ, ૧૩ બોટલ ઈંગ્લીશ દારૂ, ૦૭ બિયરટીન અને ૦૧ મોટર સાયકલ કબજે કર્યું હતું.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૩૦/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૭૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી.૯૩ મુજબ ૧૨ વ્યક્તિઓની અને પાસા મુજબ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીડીની ફરીયાદ :-

સમાચાર યાદી નં.૫૩૧/૧૬

શહેરકોટડા : પાણલબહેન બટુકભાઈ પાલનપુરા (રહે.ફીમેલ હેલ્થ તાલીમ શાળા, રાપર, તા.રાપર, કચ્છ-ભુજ) એ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ૦૦/૧૬ નંબરથી ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૩/૧૬ ના કલાક ૮/૧૫ થી ૮/૪૫ વાગ્યા દરમિયાન ગીતામંદિર એસ.ટી.બસ સ્ટેન્ડ નજીક પાણલબહેનને એક પુરુષ (૪૦ થી ૪૫ વર્ષના આશરાનો) નજીક આવી, પોતે હેલ્થ વિભાગનાં કર્મચારી હોવાની ઓળખ આપી, પાણલબહેનને વિશ્વાસમાં લઈ, પોતાની એક્ટીવા ઉપર બેસાડી સરસપુર વોરાનાં રોડ ખાતે નવા બનતાં રોડ સુધીની મુસાફરી દરમિયાન પાણલબહેનની નજર ચુકવી થેલાંમાંથી રોકડ રૂપિયા ૭૦,૦૦૦/-, મોબાઇલ ફોન અને જરૂરી દસ્તાવેજ ચોરી કરી, પાણલબહેનને સરસપુર ખાતે ઉતારી દઈ અજાણ્યો પુરુષ પલાયન થઈ ગયો હતો. આ ગુનાની તપાસ શહેરકોટડા પોલીસ સ્ટેશન થી કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરેલ છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૫૩૨/૧૬

સેટેલાઇટ : રાજવીબહેન ગોપાલભાઈ પોકિયા (રહે.નંદન એપાર્ટમેન્ટ, રામદેવનગર, સેટેલાઇટ) એ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૩/૧૬ સવારના ૮/૦૦ થી બપોરનાં ૪/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનનાં દરવાજાની જાળીમાં લટકાવેલ ચાવી વડે તાળુ ખોલી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, લેપટોપ નંગ-૨ અને મોબાઇલ ફોન મળી કુલ કિંમત રૂપિયા ૪૧,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ મ.સ.ઈ.શ્રી ભગવાનભાઈ મોતીભાઈ ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઇ ગયા:-

સમાચાર યાદી નં.૫૩૩/૧૬

સોલા હાઇકોર્ટ : મહેશકુમાર નાનજીભાઇ પંચાલ (રહે,ભાગ્યલક્ષ્મી સોસાયટી, ભાવિક સ્કુલની બાજુમાં, ચાંદલોડીયા) એ તા.૨૧/૩/૧૬ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૩/૧૬ બપોરના ૪/૦૦ વાગ્યાના સુમારે પોતાની માતાને મોટર સાયકલ પાછળ બેસાડી આઇ.યુ.સી.સીટી ફ્લેટની સામે, માધવ ફાર્મ તરફ જવાનાં રોડ આવેલ સિલ્વર સ્ટાર ચાર રસ્તા નજીકથી પસાર થઇ રહ્યા હતા દરમ્યાન એક સ્ટનર મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ (૨૦ થી ૨૫ વર્ષના આશરના) મહેશકુમારની માતાનાં ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.બી.સૈયદ ચલાવે છે.

પાણીની ટાંકી ઉપરથી પડી જતાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૫૩૪/૧૬

સાબરમતી : મેથ્યુ જસ્ટે મંડલ (ઉ.વ.૧૮) (રહે,રેલવે કોલોની, સાબરમતી) તા.૨૦/૩/૧૬ ના કલાક ૧૨/૦૦ વાગ્યાનાં સુમારે ન્યુ રેલવે કોલોની, કેન્દ્રીય વિદ્યાલયની સામે, પાણીની ટાંકી ઉપરથી પડી જતાં સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. જ્યાં તા.૨૦/૩/૧૬ સાંજનાં ૭/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ હે.કો.શ્રી રસીકભાઇ વિક્રલભાઇ ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૫૩૫/૧૬

“એન” ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન : ભવરસિંહ ગુલાબસિંહ ચૌહાણ (રહે.રામબાગ સોસાયટી, કર્ણાવતી ક્લબની પાછળ, બોપલ) એ “એન” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૩/૧૬ રાતનાં ૧૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના મોટા ભાઈ રતનસિંહ (ઉ.વ.૩૫) લકઝરી બસ નંબર જીજી.૧.ડી.એક્સ.૦૦૮૯ માં કંડકટર તરીકે નોકરી કરતાં હતા દરમ્યાન લકઝરીબસનો ચાલક જશવંતભાઇ મસુરભાઇ ડામોર(રહે.શ્રીહરી ટ્રાવેલ્સ, જોધપુર સેટેલાઇટ)નાએ લકઝરીબસ પુરઝડપે અને બેદરકારીથી ચલાવતાં, સેટેલાઇટ ઇસ્ક્રોન ચાર રસ્તા, વાઇડ એંગલ સીનેમા સામે, રતનસિંહ બસનાં દરવાજામાંથી બહાર પડી જતાં, બસનાં ટાયર નીચે આવી જતાં રતનસિંહને શરીરે ગંભીર ઈજાઓ થતાં, સ્થળ ઉપર તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ ગુનાની તપાસ પો.ઇ. શ્રી બી.એમ.લશ્કરી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.